



Ami Organics Limited

CIN. : L24100GJ2007PLCO51093

Registered Office :- Plot No. 440/4, 5 & 6, Road No. 82/A, G.I.D.C. Sachin, Surat - 394230, Dist. Surat, Gujarat, India.

May 13, 2024

To,
The Listing Department,
BSE LIMITED,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Fort
Mumbai- 400 001

To,
The Listing Department
National Stock Exchange of India Limited,
Exchange Plaza, 5th Floor, Plot no. C-1,
G-Block, Bandra Kurla Complex,
Mumbai -400051

Scrip Code: 543349

NSE Symbol: AMIORG

Subject: Newspaper Publication of Audited Financial Results of the Company for the fourth quarter and year ended March 31, 2024

Dear Sir/Madam,

In accordance with Regulation 30 & 47 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith newspaper publication of Standalone and Consolidated Audited Financial Results for the fourth quarter and year ended on March 31, 2024 published on Sunday, May 12, 2024 in Financial Express(All India Edition) & Loksatta Jansatta (Gujarat Edition) newspapers.

Kindly take the same on record.

Yours faithfully,
For, AMI ORGANICS LIMITED



CS Ekta Kumari Srivastava
Company Secretary & Compliance Officer

Encl: As above



Info@amiorganics.com




www.amiorganics.com



+91 72279 77744 / 75730 15366

દુબઈ, સિંગાપોર, ચિલી, સાઉથ કોરિયા, જર્મની ફેવરિટ દેશ બનતાં જાય છે

વિદેશમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ ૧૫ લાખ સુધી પહોંચી ગઈ



લાખને પાર કરી જશે અને ૨૦૨૭ સુધીમાં ૩૦ લાખ સુધી પહોંચી શકે છે. છેલ્લા પાંચ વર્ષમાં ચિન ઘણું બદલાયું છે કારણ કે અગાઉ ટોચની ૫૦૦ યુનિવર્સિટીઓમાંથી મોટા ભાગની યુનિવર્સિટીઓ આ ચાર દેશોની હતી. આ વિસ્તરમાં બીજા દેશો પણ ઉમેરાઈ રહ્યા છે. તેના કારણે દુબઈ, સિંગાપોર, ચિલી, જાપાન, સાઉથ કોરિયા, અલ્બાનિયા અને ૨૦૨૭ સુધીમાં આ આંકડો ૨૦

ભારતીયોને આ દેશો બહુ ખર્ચાળ લાગે છે, વિદ્યા અને વર્કને લગતાં ઘણા નિયંત્રણો છે અને ઈકોનોમિક તક પણ ઘટતી જાય છે.

જર્મની અને નેધરલેન્ડ્સ પણ હવે ફેવરિટ દેશ બનતા જાય છે. આ દેશોમાં પણ એજ્યુકેશનનું લેવલ ઘણું સારું છે અને સ્ટુડન્ટ્સ તેનું પણ એક સપોર્ટર લેવા માગે છે. આ દેશોની ઈન્સ્ટિટ્યૂટમાં રિસર્ચની ક્વોલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે બધું ટોપ ક્લાસ છે. ભારતીય વિદ્યાર્થીઓમાં આ શિક્ષક કેવી રીતે

અર્થ્યુ તે પણ સમજવા જેવું છે. અન્યાર સુધી જે ચાર દેશ - યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા ટોપ પર રહ્યા છે ત્યાં હવે ઘણી મુશ્કેલી પેદા થઈ રહી છે. સૌથી પહેલા તો આર્થિક વિકાસદર ઘટી ગયો છે. ઈમિગ્રન્ટ વિરોધી જાતના વધનું જાય છે, ભારતીયોને આ દેશો બહુ ખર્ચાળ લાગે છે, વિદ્યા અને વર્કને લગતાં ઘણા નિયંત્રણો

શરબજારમાં છેતરપિંડી વધતાં સેબીએ આકરું વલણ દર્શાવી નવા નિયમો જારી કર્યા

શેરબજારમાં રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. જેની સાથે ગેરરીતિઓ અને છેતરપિંડી કરનારાઓની સંખ્યા પણ વધી છે. આ સમસ્યાને ધ્યાનમાં લેતાં સેબીએ આકરું વલણ દર્શાવી નવા નિયમો જારી કર્યા છે. જેમાં તે તેના કર્મચારીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી શકે છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ પોતાના કર્મચારીઓની સેવાઓને નિયંત્રિત કરતાં નિયમોમાં સંશોધન કર્યું છે. જેમાં આર્થિક નુકસાનની ભરપૂરી માટે કર્મચારીઓ પાસેથી મોટી પેનલ્ટી પણ વસૂલી શકે છે. આ વસૂલાત કર્મચારીઓને મળતા પગાર અને અન્ય રકમમાંથી કરશે. સેબી આ નિયમ અંતર્ગત તેના કોઈ કર્મચારી દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરવામાં આવે અથવા તો કોઈ કર્મચારી કથિત રૂપે અયોગ્ય લક્ષ્યો માટે ફોંડ કરે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરી આર્થિક નુકસાન પેટે પેનલ્ટી પણ વસૂલાતમાં આવશે. સેબીના રિટાયર્ડ કર્મચારીઓને પણ આ નવા નિયમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સેબીએ દ મેના રોજ એક નોટિફિકેશન જારી કરી જણાવ્યું હતું કે, નવી વ્યવસ્થા તેના કર્મચારીઓ પર લાગુ થશે, જેઓએ રાજીનામું આપી દીધું છે અથવા તો રિટાયર થઈ ગયા છે. જો તેઓ માર્કેટ સંબંધિત કોઈ ખોટી જાહેરાતો કે ગેરરીતિ આચરતાં હશે તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાશે.

ભારતનું યોગદાન અમેરિકન ટેક ફિલ્ડથી લઈ નાનાથી મોટા તમામ ક્ષેત્રે અમૂલ્ય



અમેરિકામાં ભારતીયો આવ્યા તો મોટાભાગની ટેક બેઝબાઈ જશે એ કસથી વિદ્યા કાપ મૂકાયો

અમેરિકાના લોકોને એટલે જ આવી એક મર્યાદા નક્કી કરી છે કારણ કે તેમને પણ ખબર છે કે જો ભારતીયો વધારે ત્યાં આવશે તો બધી જ ટેક ફિલ્ડની જોબ પર તેમનું વ્યવસ્થાપિત થઈ જશે. ભારત સિલિકોન વેલીમાં ઈનોવેશનના સૌથી મોટા લીડરમાંથી એક છે. આ એક એક્ટિવ કરવામાં આવેલા ડેટા આધારિત છે કારણ કે સિલિકોન વેલીના ૪૦ ટકા સીઈઓ અથવા સ્થાપકો દક્ષિણ એશિયા અથવા ભારતના છે. સિલિકોન વેલી અને ભારત વચ્ચેના સંબંધની ચર્ચા કરનારા વક્તા અનુસાર, ભારતીય ઈમિગ્રન્ટ્સ અને ભારતીય અમેરિકનો ઈનોવેશન અને ઉદ્યોગસાહસિકતા પર નોંધપાત્ર અસર કરે છે. ભારતીયો ટેક ફિલ્ડ માટે પાવર સોર્સ છે એમ કહીએ તો પણ ખોટું નથી. સ્પીકરે આ સફળતામાં ફાળો આપનારા અનેક

શોધવામાં નિષ્ણાત છે. આન સામાન્ય રીતે આપણે જુગાડ કહી છીએ. ભારતીયોને જે કઈ પણ જોઈએ છે તે કોઈના કોઈ જુગાડ કરીને મેળવી જ લેતા હોય છે. જળી ટેકનોલોજીનું એવજ આપણા ભારતીયોના લોહીમાં છે અને પણ તેમણે કહ્યું હતું. સિલિકોન વેલી સેન્ટ્રલ યેમ્બર ઓફ કોમર્સના સીઈઓએ યુ.એસ.માં ટેક ઉદ્યોગની સફળતાને આગળ વધારવામાં ભારતીયોની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ઉદ્યોગને ખર્ચ-અસરકારક મોડલથી ફાયદો થાય છે, જેને બોલાવવાની ભાષામાં 'શ્રી-ટુ-વન મોડલ' તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં યુ.એસ. માં એક કર્મચારીની કિંમત ભારતના રાજ્ય કર્મચારીઓની ભરાબર છે. હરબીર કે ભાટિયાના મતે, આ આર્થિક કાર્યક્ષમતા અમેરિકામાં વિકાસશીલ ટેક લેન્ડરકેપના ચાવી છે. અને ભારતમાંથી કેટલાક પ્રતિભાશાળી લોકોને લાવ્યા છીએ. તેથી જ તેઓ વિદ્યા પર કેપ લગાવવાનો પ્રયાસ કરતા રહે છે.

રોકાણ કરવા માટે આજના સમયમાં અનેક વિકલ્પ ઉપલબ્ધ

પોસ્ટ ઓફિસમાં મહિને ૧૦૦૦નું રોકાણ કરી લાભપતિ બનવાની તક

સ્ક્રીમમાં રોકાણ કરશો તો કેટલાક વર્ષમાં ૮ લાખ રૂપિયાથી વધુની રકમ ભેગી કરી શકો છો. જાણો કઈ રીતે. જો તમે આ સ્ક્રીમમાં દર મહિને ૧૦૦૦ રૂપિયાનું રોકાણ કરો છો તો વર્ષમાં ૧૨૦૦૦ રૂપિયાનું રોકાણ થશે. આ સ્ક્રીમ ૧૫ વર્ષ બાદ મેચ્યોર થશે, પરંતુ તમારે તેને બે વખત ૫-૫ વર્ષના બ્લોકમાં એક્સટેન્ડ કરવાની છે અને સતત ૨૫ વર્ષ સુધી રોકાણ કરવાનું છે. જો તમે ૨૫ વર્ષ સુધી દર મહિને ૧૦૦૦ રૂપિયાનું રોકાણ કરશો તો તમે કુલ રોકાણ ૩ લાખનું કરશો.

રોકાણકારો સાવધાન: માર્કેટમાં મોટો કડાકો થવાની સંભાવના



ઈન્ડેક્સથી દૂર રહેવાની સલાહ આપી છે. માર્કેટ ગુરુએ કહ્યું હતું કે, માર્કેટમાં ચોક્કસ કરેક્શન આવશે. જો કે તે ક્યારે આવશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ તે ચોક્કસ આવશે. તેમણે કહ્યું હતું કે, મેના બીજા સમાહથી રોકાણકારોએ થોડું સાવધાન રહેવું પડશે. નિષ્ણાતોએ કમાણીની મોસમને કારણે રોકાણકારોને તેમના રકાર પર મિડકેપ રાખવાની સલાહ આપી હતી. ભરીને કહ્યું હતું કે, લાઈફસેવમાંથી બહાર નીકળો. થોડો નોકો ઘરે લઈ જાઓ. શેરબજારના નિષ્ણાતે કહ્યું છે કે તે આ વાત પોતાના અનુભવ પરથી કહી રહ્યા છે. સોનું, ચાંદી ઓલ ટાઈમ હાઈ પર છે. યેન રેકોર્ડ નીચા

રત્તર છે. સ્ટોકસ તેમના ઉચ્ચતમ સ્તર પર છે. બોન્ડ્સ પણ ઉચ્ચ સ્તરે છે. તેમણે કહ્યું હતું કે, મને તારીખ ખબર નથી, તે આવતા મહિનાની ૭મી, ૧૨મી કે ૧૫મી હોઈ શકે છે. પરંતુ વેચવાલીનો તબક્કો ચોક્કસપણે નિષ્ક્રી ઝંઝે ભરીને કહ્યું હતું કે, આ ઉત્સાહપૂર્ણ તેજમાં ઈન્ડેક્સ ૨૩૦૦૦નું સ્તર બતાવી શકે છે, પરંતુ પતન હજુ પણ આવશે. તેમણે કહ્યું હતું કે, જો તમે ૨૧ ૭૦૦ની નીચે જશો તો ઈન્ડેક્સ ખરાબ રીતે ઘટી શકે છે. વિદેશી બજારોમાં મિશ્ર સોલ્ટિંગન્ટ વચ્ચે આઈટી અને પાવર સેક્ટરના શેરોમાં છેલ્લા રાઉન્ડની વેચવાલીથી બજારે મંજળવારે તેનો પ્રારંભિક લાભ ગુમાવ્યો હતો. બંને મુખ્ય સૂચકાંકો નુકસાન સાથે બંધ થયા હતા. બીએસઈનો ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ બે દિવસ સુધી વધતા જતા વલણને ચાલુ રાખી શક્યો નથી.

રિઝર્વ બેંક દ્વારા કેન્દ્ર સરકારને લગભગ ૧ લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે તેવી શક્યતા

તાજેતરના એક રિપોર્ટમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ સરકારી બજારનામો રિઝર્વ બેંક તરફથી મળતા ડિવિડન્ડ અંગે આગાહી વ્યક્ત કરી છે કે રિઝર્વ બેંક દ્વારા કેન્દ્ર સરકારને લગભગ ૧ લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. ગયા મહિને શરૂ થયેલું નવું નાણાકીય વર્ષ સરકારી તિજોરી માટે ખૂબ જ સારું સાબિત થઈ શકે છે. આ નાણાકીય વર્ષમાં સરકારી તિજોરીને રિઝર્વ બેંક તરફ રોકોડ પેમેન્ટ મળી શકે છે અને આંકડો ૧ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટમાં હવેવામાં આવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં રિઝર્વ બેંક દ્વારા કેન્દ્ર સરકારને લગભગ

Table with 2 columns: 31st March, 2024 and 31st March, 2023. Rows include various financial metrics like Total Income, Total Expenditure, etc.

Advertisement for AMI ORGANICS LIMITED, featuring a logo and contact information. Text includes 'રફ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ પોસ્ટલ બેલેટની સૂચના મોકલી સુધારવા' and 'અમારું પ્રેરણાત્મક માર્ગદર્શક'.

SAGARSOFT (INDIA) LIMITED							
CIN: L27200TG1996PLC02323							
Regd. Office : Plot No. 111, Road No. 10, Jubilee Hills, Hyderabad-500 033.							
Phone: 040 67191000 Fax: 040 23114607.							
Website: www.sagarsoft.in email: info@sagarsoft.in							
STATEMENT OF AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED AND YEAR ENDED 31st MARCH 2024							
Sl. No.	Particulars	Consolidated					
		Quarter ended		Year Ended			
		March 31, 2024	December 31, 2023	March 31, 2024	March 31, 2023	2024	2023
		(Audited)	(UnAudited)	(Audited)	(Audited)	(Audited)	(Audited)
1	Total Income from Operations	3957.65	4482.58	3459.15	15219.18	16415.30	
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	208.10	504.76	86.09	1138.18	1059.41	
3	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	208.10	504.76	86.09	1138.18	1059.41	
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	164.06	356.78	61.67	833.78	762.71	
5	Net Profit/(Loss) attributable to:						
	- Shareholders of the Holding Company	169.88	356.78	61.67	839.60	762.71	
	- Non-controlling interest	(5.82)	-	-	(5.82)	-	
	Total Comprehensive Income for the Period (Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax))	132.25	351.38	35.88	819.16	862.47	
6	Paid-up Equity share capital (Face Value Rs. 10/- Per share)	639.22	639.22	639.22	639.22	639.22	
7	Reserves excluding revaluation reserve as at Balance Sheet date				6217.26	5534.90	
8	Earnings per share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) Basic and Diluted:	2.66	5.58	0.96	13.13	11.93	

Notes:

- The standalone and consolidated financial results of the company have been prepared in accordance with the Indian Accounting Standards as prescribed under Section 133 of the Companies Act, 2013 ("the Act") read with relevant rules issued thereunder ("Ind AS") and other accounting principles generally accepted in India and guidelines issued by the Securities and Exchange Board of India ("SEBI").
- The consolidated audited financial results for the quarter and year ended 31st March, 2024, includes the results of Sagarsoft (India) Limited ("the Holding Company") and its wholly owned subsidiary, IT CATS LLC, USA which was acquired on 26th July, 2021.
- Financial results of Sagarsoft (India) Limited (Standalone information)

Sl. No.	Particulars	Standalone					
		Quarter ended		Year Ended			
		March 31, 2024	December 31, 2023	March 31, 2024	March 31, 2023	2024	2023
		(Audited)	(UnAudited)	(Audited)	(Audited)	(Audited)	(Audited)
1	Total Income from Operations	1484.28	1642.16	1125.09	5513.78	4948.75	
2	Profit / (Loss) before tax	47.33	278.14	(112.24)	487.32	204.50	
3	Profit / (Loss) after tax	33.73	217.89	(78.95)	371.77	136.94	

Notes:

- The above is an extract of the detailed format of the audited Standalone and Consolidated Financial results for the quarter ended 31st March, 2024 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.
- The full format of audited standalone and consolidated results of the company for the fourth quarter and year ended 31st March, 2024 are available on the Company's website (<https://www.sagarsoft.in>) and on the website of the BSE Limited (www.bseindia.com).
- The above standalone and consolidated audited financial results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meeting held on May 10, 2024.
- The Statutory Auditors have expressed an unmodified opinion on the financial results for the year ended March 31, 2024 and have issued unmodified conclusion in respect of the limited review of the quarter ended March 31, 2024.
- The Board of Directors of the company has recommended a dividend of Rs.2.00 (20%) per equity share of face value of Rs.10/- each for the financial year 2023-24.

for Sagarsoft (India) Limited
Sd/-
M. Jagadeesh
Managing Director

Place: Hyderabad
Date: 10.05.2024

ORIENT TRADELINK LTD.									
Regd. Office: Office Address: 801-A, 8th Floor, Mahalaya Complex, Opp: Hotel President, B/H. Fairdeal House, Swastik Cross Roads, Off: C.G. Road, Navrangpura, Ahmedabad: 380 009. Tel: 30925866									
E-Mail: orient.tradelink@gmail.com, Website: www.orienttradelink.in									
PUBLIC ANNOUNCEMENT									
This announcement is in the furtherance of the announcement dated Wednesday, 8th May, 2024 pursuant to the proposed Right Issue of the Orient Tradelink Limited. We wish to inform you that as per information received from BSE through its e-mail dated 10th May 2024, the proposed rights issue will not open as per provided schedule i.e. Monday, 13th May 2024. The revised timelines and other information will be due course. <tr> <td colspan="2">We apologize for any inconvenience this announcement may cause and appreciate your understanding and continued support. Should you have any questions or require further clarification, please do not hesitate to contact our Investor Relations department at Email: orienttradelink@gmail.com. <tr> <td colspan="2">Thank you for your attention to this matter. <tr> <td colspan="2" style="text-align: center;">For and on behalf of Orient Tradelink Limited Sd/- Aushim Khetarpal Managing Director DIN: 00660319</td> </tr> <tr> <td colspan="2">Date: 11.05.2023</td> </tr> </td></tr></td></tr>		We apologize for any inconvenience this announcement may cause and appreciate your understanding and continued support. Should you have any questions or require further clarification, please do not hesitate to contact our Investor Relations department at Email: orienttradelink@gmail.com . <tr> <td colspan="2">Thank you for your attention to this matter. <tr> <td colspan="2" style="text-align: center;">For and on behalf of Orient Tradelink Limited Sd/- Aushim Khetarpal Managing Director DIN: 00660319</td> </tr> <tr> <td colspan="2">Date: 11.05.2023</td> </tr> </td></tr>		Thank you for your attention to this matter. <tr> <td colspan="2" style="text-align: center;">For and on behalf of Orient Tradelink Limited Sd/- Aushim Khetarpal Managing Director DIN: 00660319</td> </tr> <tr> <td colspan="2">Date: 11.05.2023</td> </tr>		For and on behalf of Orient Tradelink Limited Sd/- Aushim Khetarpal Managing Director DIN: 00660319		Date: 11.05.2023	
We apologize for any inconvenience this announcement may cause and appreciate your understanding and continued support. Should you have any questions or require further clarification, please do not hesitate to contact our Investor Relations department at Email: orienttradelink@gmail.com . <tr> <td colspan="2">Thank you for your attention to this matter. <tr> <td colspan="2" style="text-align: center;">For and on behalf of Orient Tradelink Limited Sd/- Aushim Khetarpal Managing Director DIN: 00660319</td> </tr> <tr> <td colspan="2">Date: 11.05.2023</td> </tr> </td></tr>		Thank you for your attention to this matter. <tr> <td colspan="2" style="text-align: center;">For and on behalf of Orient Tradelink Limited Sd/- Aushim Khetarpal Managing Director DIN: 00660319</td> </tr> <tr> <td colspan="2">Date: 11.05.2023</td> </tr>		For and on behalf of Orient Tradelink Limited Sd/- Aushim Khetarpal Managing Director DIN: 00660319		Date: 11.05.2023			
Thank you for your attention to this matter. <tr> <td colspan="2" style="text-align: center;">For and on behalf of Orient Tradelink Limited Sd/- Aushim Khetarpal Managing Director DIN: 00660319</td> </tr> <tr> <td colspan="2">Date: 11.05.2023</td> </tr>		For and on behalf of Orient Tradelink Limited Sd/- Aushim Khetarpal Managing Director DIN: 00660319		Date: 11.05.2023					
For and on behalf of Orient Tradelink Limited Sd/- Aushim Khetarpal Managing Director DIN: 00660319									
Date: 11.05.2023									

AMI ORGANICS LIMITED													
Reg. Office: Plot No. 440/4, 5 & 6, Road No. 82/A, GIDC Sachin, Surat- 394230 Gujarat													
Email id: investorinfo@amiorganics.com													
CIN: L24100GJ2007PLC051093													
Website: www.amiorganics.com													
CORRIGENDUM TO NOTICE OF POSTAL BALLOT DATED APRIL 26, 2024													
This has reference to the Postal Ballot Notice dated April 26, 2024 ("Notice") issued by the Company for the purpose of seeking members approval by way of Special Resolution for issue of 7,39,193 Equity Shares on Preferential basis. The Notice has already been circulated to all the shareholders of the Company on April 27, 2024. This corrigendum is being issued to inform the shareholders of the Company regarding change in Explanatory Statement of the Notice. The existing content shall stand replaced with the following: <tr> <td colspan="2">1. Para 1 (i) of Point no. (d) is modified and shall be read as under: The Equity Shares of Company are listed on Stock Exchange i.e. BSE Limited ("BSE") and National Stock Exchange of India Limited ("NSE") (together referred to as the "Stock Exchanges"). The Equity Shares are frequently traded in accordance with SEBI ICDR Regulations. For the purpose of computation of the price per Equity Share, NSE being the stock exchange with higher trading volumes for the preceding ninety trading days prior to Relevant Date i.e. April 26, 2024, has been considered for determining the floor price in accordance with the SEBI ICDR Regulations. <tr> <td colspan="2">2. Point no. (a) is modified and shall be read as under: As per Regulation 163(2) of the ICDR Regulations, the Company is required to place a copy of the certificate of a practicing company secretary before the shareholders considering the proposed Preferential Issue, certifying that the issue is being made in accordance with the requirements of SEBI ICDR Regulations. Accordingly, a revised certificate from Mr. Kashyap Shah (FCS No. 7662) of M/s Kashyap Shah & Co. Practicing Company Secretaries dated May 06, 2024, incorporating change as to "the highest trading volume in respect of the equity shares of the issuer has been recorded during the preceding 90 trading days prior to the relevant date on NSE" has been obtained by the Company. The copy of the said certificate shall be made available for inspection by the members during business hours on all working days upto the last date of e-voting period and is also hosted on website of the Company which can be accessed at the link : https://www.amiorganics.com/static/uploads/dfs/downloads/download_8186.pdf?20240511050657 <tr> <td colspan="2">This Corrigendum should be read in continuation of and in conjunction with the notice. All other contents of the Notice, save and except as amended by this Corrigendum, shall remain unchanged. Please note that shareholders who have not voted are required to vote as per the instructions provided in the Postal Ballot Notice. However, shareholders who have already voted before the issue of this Corrigendum, have the option to alter / modify their assent or dissent by giving email to the Scrutinizer Mr. Kashyap Shah at Email id : kashyap.cs@gmail.com on or before May 15, 2024. <tr> <td colspan="2">For any queries/grievances regarding the corrigendum to the Notice of Postal Ballot dated April 26, 2024, please contact CS Ekta Kumari Srivastava, Company Secretary and Compliance Officer at 722797744 or email at cs@amiorganics.com <tr> <td colspan="2" style="text-align: center;">For Ami Organics Limited Sd/- CS Ekta Kumari Srivastava Company Secretary & Compliance Officer</td> </tr> <tr> <td colspan="2">Place: Surat Date : May 11, 2024</td> </tr> </td></tr></td></tr></td></tr></td></tr>		1. Para 1 (i) of Point no. (d) is modified and shall be read as under: The Equity Shares of Company are listed on Stock Exchange i.e. BSE Limited ("BSE") and National Stock Exchange of India Limited ("NSE") (together referred to as the "Stock Exchanges"). The Equity Shares are frequently traded in accordance with SEBI ICDR Regulations. For the purpose of computation of the price per Equity Share, NSE being the stock exchange with higher trading volumes for the preceding ninety trading days prior to Relevant Date i.e. April 26, 2024, has been considered for determining the floor price in accordance with the SEBI ICDR Regulations. <tr> <td colspan="2">2. Point no. (a) is modified and shall be read as under: As per Regulation 163(2) of the ICDR Regulations, the Company is required to place a copy of the certificate of a practicing company secretary before the shareholders considering the proposed Preferential Issue, certifying that the issue is being made in accordance with the requirements of SEBI ICDR Regulations. Accordingly, a revised certificate from Mr. Kashyap Shah (FCS No. 7662) of M/s Kashyap Shah & Co. Practicing Company Secretaries dated May 06, 2024, incorporating change as to "the highest trading volume in respect of the equity shares of the issuer has been recorded during the preceding 90 trading days prior to the relevant date on NSE" has been obtained by the Company. The copy of the said certificate shall be made available for inspection by the members during business hours on all working days upto the last date of e-voting period and is also hosted on website of the Company which can be accessed at the link : https://www.amiorganics.com/static/uploads/dfs/downloads/download_8186.pdf?20240511050657 <tr> <td colspan="2">This Corrigendum should be read in continuation of and in conjunction with the notice. All other contents of the Notice, save and except as amended by this Corrigendum, shall remain unchanged. Please note that shareholders who have not voted are required to vote as per the instructions provided in the Postal Ballot Notice. However, shareholders who have already voted before the issue of this Corrigendum, have the option to alter / modify their assent or dissent by giving email to the Scrutinizer Mr. Kashyap Shah at Email id : kashyap.cs@gmail.com on or before May 15, 2024. <tr> <td colspan="2">For any queries/grievances regarding the corrigendum to the Notice of Postal Ballot dated April 26, 2024, please contact CS Ekta Kumari Srivastava, Company Secretary and Compliance Officer at 722797744 or email at cs@amiorganics.com <tr> <td colspan="2" style="text-align: center;">For Ami Organics Limited Sd/- CS Ekta Kumari Srivastava Company Secretary & Compliance Officer</td> </tr> <tr> <td colspan="2">Place: Surat Date : May 11, 2024</td> </tr> </td></tr></td></tr></td></tr>		2. Point no. (a) is modified and shall be read as under: As per Regulation 163(2) of the ICDR Regulations, the Company is required to place a copy of the certificate of a practicing company secretary before the shareholders considering the proposed Preferential Issue, certifying that the issue is being made in accordance with the requirements of SEBI ICDR Regulations. Accordingly, a revised certificate from Mr. Kashyap Shah (FCS No. 7662) of M/s Kashyap Shah & Co. Practicing Company Secretaries dated May 06, 2024, incorporating change as to "the highest trading volume in respect of the equity shares of the issuer has been recorded during the preceding 90 trading days prior to the relevant date on NSE" has been obtained by the Company. The copy of the said certificate shall be made available for inspection by the members during business hours on all working days upto the last date of e-voting period and is also hosted on website of the Company which can be accessed at the link : https://www.amiorganics.com/static/uploads/dfs/downloads/download_8186.pdf?20240511050657 <tr> <td colspan="2">This Corrigendum should be read in continuation of and in conjunction with the notice. All other contents of the Notice, save and except as amended by this Corrigendum, shall remain unchanged. Please note that shareholders who have not voted are required to vote as per the instructions provided in the Postal Ballot Notice. However, shareholders who have already voted before the issue of this Corrigendum, have the option to alter / modify their assent or dissent by giving email to the Scrutinizer Mr. Kashyap Shah at Email id : kashyap.cs@gmail.com on or before May 15, 2024. <tr> <td colspan="2">For any queries/grievances regarding the corrigendum to the Notice of Postal Ballot dated April 26, 2024, please contact CS Ekta Kumari Srivastava, Company Secretary and Compliance Officer at 722797744 or email at cs@amiorganics.com <tr> <td colspan="2" style="text-align: center;">For Ami Organics Limited Sd/- CS Ekta Kumari Srivastava Company Secretary & Compliance Officer</td> </tr> <tr> <td colspan="2">Place: Surat Date : May 11, 2024</td> </tr> </td></tr></td></tr>		This Corrigendum should be read in continuation of and in conjunction with the notice. All other contents of the Notice, save and except as amended by this Corrigendum, shall remain unchanged. Please note that shareholders who have not voted are required to vote as per the instructions provided in the Postal Ballot Notice. However, shareholders who have already voted before the issue of this Corrigendum, have the option to alter / modify their assent or dissent by giving email to the Scrutinizer Mr. Kashyap Shah at Email id : kashyap.cs@gmail.com on or before May 15, 2024. <tr> <td colspan="2">For any queries/grievances regarding the corrigendum to the Notice of Postal Ballot dated April 26, 2024, please contact CS Ekta Kumari Srivastava, Company Secretary and Compliance Officer at 722797744 or email at cs@amiorganics.com <tr> <td colspan="2" style="text-align: center;">For Ami Organics Limited Sd/- CS Ekta Kumari Srivastava Company Secretary & Compliance Officer</td> </tr> <tr> <td colspan="2">Place: Surat Date : May 11, 2024</td> </tr> </td></tr>		For any queries/grievances regarding the corrigendum to the Notice of Postal Ballot dated April 26, 2024, please contact CS Ekta Kumari Srivastava, Company Secretary and Compliance Officer at 722797744 or email at cs@amiorganics.com <tr> <td colspan="2" style="text-align: center;">For Ami Organics Limited Sd/- CS Ekta Kumari Srivastava Company Secretary & Compliance Officer</td> </tr> <tr> <td colspan="2">Place: Surat Date : May 11, 2024</td> </tr>		For Ami Organics Limited Sd/- CS Ekta Kumari Srivastava Company Secretary & Compliance Officer		Place: Surat Date : May 11, 2024	
1. Para 1 (i) of Point no. (d) is modified and shall be read as under: The Equity Shares of Company are listed on Stock Exchange i.e. BSE Limited ("BSE") and National Stock Exchange of India Limited ("NSE") (together referred to as the "Stock Exchanges"). The Equity Shares are frequently traded in accordance with SEBI ICDR Regulations. For the purpose of computation of the price per Equity Share, NSE being the stock exchange with higher trading volumes for the preceding ninety trading days prior to Relevant Date i.e. April 26, 2024, has been considered for determining the floor price in accordance with the SEBI ICDR Regulations. <tr> <td colspan="2">2. Point no. (a) is modified and shall be read as under: As per Regulation 163(2) of the ICDR Regulations, the Company is required to place a copy of the certificate of a practicing company secretary before the shareholders considering the proposed Preferential Issue, certifying that the issue is being made in accordance with the requirements of SEBI ICDR Regulations. Accordingly, a revised certificate from Mr. Kashyap Shah (FCS No. 7662) of M/s Kashyap Shah & Co. Practicing Company Secretaries dated May 06, 2024, incorporating change as to "the highest trading volume in respect of the equity shares of the issuer has been recorded during the preceding 90 trading days prior to the relevant date on NSE" has been obtained by the Company. The copy of the said certificate shall be made available for inspection by the members during business hours on all working days upto the last date of e-voting period and is also hosted on website of the Company which can be accessed at the link : https://www.amiorganics.com/static/uploads/dfs/downloads/download_8186.pdf?20240511050657 <tr> <td colspan="2">This Corrigendum should be read in continuation of and in conjunction with the notice. All other contents of the Notice, save and except as amended by this Corrigendum, shall remain unchanged. Please note that shareholders who have not voted are required to vote as per the instructions provided in the Postal Ballot Notice. However, shareholders who have already voted before the issue of this Corrigendum, have the option to alter / modify their assent or dissent by giving email to the Scrutinizer Mr. Kashyap Shah at Email id : kashyap.cs@gmail.com on or before May 15, 2024. <tr> <td colspan="2">For any queries/grievances regarding the corrigendum to the Notice of Postal Ballot dated April 26, 2024, please contact CS Ekta Kumari Srivastava, Company Secretary and Compliance Officer at 722797744 or email at cs@amiorganics.com <tr> <td colspan="2" style="text-align: center;">For Ami Organics Limited Sd/- CS Ekta Kumari Srivastava Company Secretary & Compliance Officer</td> </tr> <tr> <td colspan="2">Place: Surat Date : May 11, 2024</td> </tr> </td></tr></td></tr></td></tr>		2. Point no. (a) is modified and shall be read as under: As per Regulation 163(2) of the ICDR Regulations, the Company is required to place a copy of the certificate of a practicing company secretary before the shareholders considering the proposed Preferential Issue, certifying that the issue is being made in accordance with the requirements of SEBI ICDR Regulations. Accordingly, a revised certificate from Mr. Kashyap Shah (FCS No. 7662) of M/s Kashyap Shah & Co. Practicing Company Secretaries dated May 06, 2024, incorporating change as to "the highest trading volume in respect of the equity shares of the issuer has been recorded during the preceding 90 trading days prior to the relevant date on NSE" has been obtained by the Company. The copy of the said certificate shall be made available for inspection by the members during business hours on all working days upto the last date of e-voting period and is also hosted on website of the Company which can be accessed at the link : https://www.amiorganics.com/static/uploads/dfs/downloads/download_8186.pdf?20240511050657 <tr> <td colspan="2">This Corrigendum should be read in continuation of and in conjunction with the notice. All other contents of the Notice, save and except as amended by this Corrigendum, shall remain unchanged. Please note that shareholders who have not voted are required to vote as per the instructions provided in the Postal Ballot Notice. However, shareholders who have already voted before the issue of this Corrigendum, have the option to alter / modify their assent or dissent by giving email to the Scrutinizer Mr. Kashyap Shah at Email id : kashyap.cs@gmail.com on or before May 15, 2024. <tr> <td colspan="2">For any queries/grievances regarding the corrigendum to the Notice of Postal Ballot dated April 26, 2024, please contact CS Ekta Kumari Srivastava, Company Secretary and Compliance Officer at 722797744 or email at cs@amiorganics.com <tr> <td colspan="2" style="text-align: center;">For Ami Organics Limited Sd/- CS Ekta Kumari Srivastava Company Secretary & Compliance Officer</td> </tr> <tr> <td colspan="2">Place: Surat Date : May 11, 2024</td> </tr> </td></tr></td></tr>		This Corrigendum should be read in continuation of and in conjunction with the notice. All other contents of the Notice, save and except as amended by this Corrigendum, shall remain unchanged. Please note that shareholders who have not voted are required to vote as per the instructions provided in the Postal Ballot Notice. However, shareholders who have already voted before the issue of this Corrigendum, have the option to alter / modify their assent or dissent by giving email to the Scrutinizer Mr. Kashyap Shah at Email id : kashyap.cs@gmail.com on or before May 15, 2024. <tr> <td colspan="2">For any queries/grievances regarding the corrigendum to the Notice of Postal Ballot dated April 26, 2024, please contact CS Ekta Kumari Srivastava, Company Secretary and Compliance Officer at 722797744 or email at cs@amiorganics.com <tr> <td colspan="2" style="text-align: center;">For Ami Organics Limited Sd/- CS Ekta Kumari Srivastava Company Secretary & Compliance Officer</td> </tr> <tr> <td colspan="2">Place: Surat Date : May 11, 2024</td> </tr> </td></tr>		For any queries/grievances regarding the corrigendum to the Notice of Postal Ballot dated April 26, 2024, please contact CS Ekta Kumari Srivastava, Company Secretary and Compliance Officer at 722797744 or email at cs@amiorganics.com <tr> <td colspan="2" style="text-align: center;">For Ami Organics Limited Sd/- CS Ekta Kumari Srivastava Company Secretary & Compliance Officer</td> </tr> <tr> <td colspan="2">Place: Surat Date : May 11, 2024</td> </tr>		For Ami Organics Limited Sd/- CS Ekta Kumari Srivastava Company Secretary & Compliance Officer		Place: Surat Date : May 11, 2024			
2. Point no. (a) is modified and shall be read as under: As per Regulation 163(2) of the ICDR Regulations, the Company is required to place a copy of the certificate of a practicing company secretary before the shareholders considering the proposed Preferential Issue, certifying that the issue is being made in accordance with the requirements of SEBI ICDR Regulations. Accordingly, a revised certificate from Mr. Kashyap Shah (FCS No. 7662) of M/s Kashyap Shah & Co. Practicing Company Secretaries dated May 06, 2024, incorporating change as to "the highest trading volume in respect of the equity shares of the issuer has been recorded during the preceding 90 trading days prior to the relevant date on NSE" has been obtained by the Company. The copy of the said certificate shall be made available for inspection by the members during business hours on all working days upto the last date of e-voting period and is also hosted on website of the Company which can be accessed at the link : https://www.amiorganics.com/static/uploads/dfs/downloads/download_8186.pdf?20240511050657 <tr> <td colspan="2">This Corrigendum should be read in continuation of and in conjunction with the notice. All other contents of the Notice, save and except as amended by this Corrigendum, shall remain unchanged. Please note that shareholders who have not voted are required to vote as per the instructions provided in the Postal Ballot Notice. However, shareholders who have already voted before the issue of this Corrigendum, have the option to alter / modify their assent or dissent by giving email to the Scrutinizer Mr. Kashyap Shah at Email id : kashyap.cs@gmail.com on or before May 15, 2024. <tr> <td colspan="2">For any queries/grievances regarding the corrigendum to the Notice of Postal Ballot dated April 26, 2024, please contact CS Ekta Kumari Srivastava, Company Secretary and Compliance Officer at 722797744 or email at cs@amiorganics.com <tr> <td colspan="2" style="text-align: center;">For Ami Organics Limited Sd/- CS Ekta Kumari Srivastava Company Secretary & Compliance Officer</td> </tr> <tr> <td colspan="2">Place: Surat Date : May 11, 2024</td> </tr> </td></tr></td></tr>		This Corrigendum should be read in continuation of and in conjunction with the notice. All other contents of the Notice, save and except as amended by this Corrigendum, shall remain unchanged. Please note that shareholders who have not voted are required to vote as per the instructions provided in the Postal Ballot Notice. However, shareholders who have already voted before the issue of this Corrigendum, have the option to alter / modify their assent or dissent by giving email to the Scrutinizer Mr. Kashyap Shah at Email id : kashyap.cs@gmail.com on or before May 15, 2024. <tr> <td colspan="2">For any queries/grievances regarding the corrigendum to the Notice of Postal Ballot dated April 26, 2024, please contact CS Ekta Kumari Srivastava, Company Secretary and Compliance Officer at 722797744 or email at cs@amiorganics.com <tr> <td colspan="2" style="text-align: center;">For Ami Organics Limited Sd/- CS Ekta Kumari Srivastava Company Secretary & Compliance Officer</td> </tr> <tr> <td colspan="2">Place: Surat Date : May 11, 2024</td> </tr> </td></tr>		For any queries/grievances regarding the corrigendum to the Notice of Postal Ballot dated April 26, 2024, please contact CS Ekta Kumari Srivastava, Company Secretary and Compliance Officer at 722797744 or email at cs@amiorganics.com <tr> <td colspan="2" style="text-align: center;">For Ami Organics Limited Sd/- CS Ekta Kumari Srivastava Company Secretary & Compliance Officer</td> </tr> <tr> <td colspan="2">Place: Surat Date : May 11, 2024</td> </tr>		For Ami Organics Limited Sd/- CS Ekta Kumari Srivastava Company Secretary & Compliance Officer		Place: Surat Date : May 11, 2024					
This Corrigendum should be read in continuation of and in conjunction with the notice. All other contents of the Notice, save and except as amended by this Corrigendum, shall remain unchanged. Please note that shareholders who have not voted are required to vote as per the instructions provided in the Postal Ballot Notice. However, shareholders who have already voted before the issue of this Corrigendum, have the option to alter / modify their assent or dissent by giving email to the Scrutinizer Mr. Kashyap Shah at Email id : kashyap.cs@gmail.com on or before May 15, 2024. <tr> <td colspan="2">For any queries/grievances regarding the corrigendum to the Notice of Postal Ballot dated April 26, 2024, please contact CS Ekta Kumari Srivastava, Company Secretary and Compliance Officer at 722797744 or email at cs@amiorganics.com <tr> <td colspan="2" style="text-align: center;">For Ami Organics Limited Sd/- CS Ekta Kumari Srivastava Company Secretary & Compliance Officer</td> </tr> <tr> <td colspan="2">Place: Surat Date : May 11, 2024</td> </tr> </td></tr>		For any queries/grievances regarding the corrigendum to the Notice of Postal Ballot dated April 26, 2024, please contact CS Ekta Kumari Srivastava, Company Secretary and Compliance Officer at 722797744 or email at cs@amiorganics.com <tr> <td colspan="2" style="text-align: center;">For Ami Organics Limited Sd/- CS Ekta Kumari Srivastava Company Secretary & Compliance Officer</td> </tr> <tr> <td colspan="2">Place: Surat Date : May 11, 2024</td> </tr>		For Ami Organics Limited Sd/- CS Ekta Kumari Srivastava Company Secretary & Compliance Officer		Place: Surat Date : May 11, 2024							
For any queries/grievances regarding the corrigendum to the Notice of Postal Ballot dated April 26, 2024, please contact CS Ekta Kumari Srivastava, Company Secretary and Compliance Officer at 722797744 or email at cs@amiorganics.com <tr> <td colspan="2" style="text-align: center;">For Ami Organics Limited Sd/- CS Ekta Kumari Srivastava Company Secretary & Compliance Officer</td> </tr> <tr> <td colspan="2">Place: Surat Date : May 11, 2024</td> </tr>		For Ami Organics Limited Sd/- CS Ekta Kumari Srivastava Company Secretary & Compliance Officer		Place: Surat Date : May 11, 2024									
For Ami Organics Limited Sd/- CS Ekta Kumari Srivastava Company Secretary & Compliance Officer													
Place: Surat Date : May 11, 2024													

AMI ORGANICS LIMITED											
Registered Address: Plot No. 440/4, 5 & 6, Road No. 82/A, GIDC Sachin, Surat- 394230											
Website: www.amiorganics.com Email: cs@amiorganics.com Tel: +91 722797744											
EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31st MARCH, 2024											
(Rs. In Lakhs, unless otherwise stated)											
Sl. No.	Particulars	Standalone				Consolidated					
		Quarter Ended		Year Ended		Quarter Ended		Year Ended			
		31-03-2024	31-12-2023	31-03-2024	31-03-2023	31-03-2024	31-12-2023	31-03-2024	31-03-2023	31-03-2024	31-03-2023
		Audited	UnAudited	Audited	Audited	Audited	UnAudited	Audited	Audited	Audited	Audited
1	Total income	22349.14	18456.92	18621.02	70136.87	62105.38	22630.04	16993.77	18621.02	72496.54	62105.43
2	Profit/(Loss) (before tax, exceptional and/or extraordinary items)	4228.74	2034.16	3662.41	10086.36	11222.47	3753.37	2370.32	3666.48	11398.52	11217.18
3	Exceptional Items	0.00	0.00	0.00	(3175.39)	0.00	(33.00)	0.00	0.00	(3208.39)	0.00
4	Profit/(Loss) (before tax, after exceptional and/or extraordinary items)	4228.74	2034.16	3662.41	6910.97	11222.47	3720.37	2370.32	3666.48	8190.13	11217.18
5	Profit/(Loss) (after tax, exceptional and/or extraordinary items)	3207.99	1570.20	2715.96	4368.49	8334.26	2567.87	-1781.26	2720.03	4870.80	8328.97
6	Total Comprehensive income for the period	3215.30	1566.03	2757.58	4359.25	8351.09	2579.43	-1777.09	3052.01	4148.44	8636.16
7	Paid up Equity Share Capital (Face value of Rs. 10/- each)	3688.06	3688.06	3643.71	3688.06	3643.71	3688.06	3688.06	3643.71	3688.06	3643.71
8	Other equity excluding revaluation reserves	-	-	-	63823.48	55034.84	-	-	-	63711.68	55752.21
9	Earning per share (of Rs. 10/- each) Basic EPS (Rs.)	8.75	4.29	7.45	11.91	22.87	6.86	4.58	7.47	11.67	22.86
	Diluted EPS (Rs.)	8.74	4.29	7.45	11.90	22.87	6.85	4.47	7.47	11.66	22.86

Notes:

- The above is an extract of the detailed format of financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the websites of the Stock Exchange(s) (www.bseindia.com and www.nseindia.com) and on company's website (www.amiorganics.com).
- The above Financial Statements have been reviewed and recommended by Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on May 10, 2024.
- The Board of Directors at their meeting held on May 10, 2024 has recommended dividend of Rs. 3/- per Equity Share (at the rate of 30% of face value of Rs. 10/- each, subject to the approval of shareholders at the ensuing Annual General Meeting).
- The figures for the quarter ended March 31, 2024 and March 31, 2023 are balancing figures between the figures for the audited financial year and year to date unaudited figures up to the third quarter of the respective financial year. The figures up to the third quarter of the current financial year have been reviewed by auditors.
- On September 25, 2023 Company allotted 4,43,500 equity shares of face value of Rs. 10/- at an issue price of Rs. 1,169/- per equity share (including share premium of Rs. 1159/- on preferential basis amounting to Rs. 5184.51 Lakhs. The company has fully utilised the entire proceeds of the Preferential issue for specified object without any deviation.

For and on behalf of Board of Directors of Ami Organics Limited
Sd/-
Virendra Nath Mishra (Whole Time Director)

Place: Surat | Date: May 11, 2024

NITTA GELATIN INDIA LIMITED												
REGD. OFFICE : NITTA CENTER, SBT AVENUE, PANAMPILLY NAGAR, KOCHI, KERALA - 682036												
(Corporate Identification number : L24299KL1975PLC002691)												
Email: investorcell@nitta-gelatin.co.in Tel: +91-484-2317805 / Fax : +91-484-2310568												
STATEMENT OF AUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31 MARCH 2024												
(Rs. In Lakhs except per share data)												
Sl No.	Particulars	STANDALONE						CONSOLIDATED				
		Quarter Ended		Year Ended		Quarter Ended		Year Ended				
		31-Mar-24	31-Dec-23	31-Mar-24	31-Mar-23	31-Mar-24	31-Dec-23	31-Mar-24	31-Mar-23	31-Mar-24	31-Mar-23	
		Audited	Unaudited	Audited	Audited	Audited	Unaudited	Audited	Audited	Audited	Audited	
1	Total Income from Operations	11,997.81	11,862.46	12,968.81	48,963.84	49,206.41	13,556.28	13,453.49	14,596.85	54,392.43	56,618.44	
2	Net Profit for the period (before Tax, Exceptional and Extra ordinary items)	2,187.99	2,335.90	1,916.44	10,987.93	7,808.34	1,990.73	2,866.33	2,311.50	11,637.85	9,609.89	
3	Net Profit for the period before Tax (after Exceptional and Extra ordinary items)	2,187.99	2,335.90	1,916.44	10,987.93	7,808.34	1,990.73	2,866.33	2,311.50	11,637.85	9,906.76	
4	Net Profit for the period after Tax (after Exceptional and Extra ordinary items)	1,629.33	1,661.40	1,383.41	8,248.50	5,876.45	1,342.35	2,052.01	1,677.47	8,410.87	7,389.99	
5	Total Comprehensive Income for the period/year (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	1,603.35	1,678.82	1,516.98	8,247.83	5,885.80	1,318.24	2,069.27	1,811.15	8,410.20	7,394.42	
6	Equity Share Capital	907.92	907.92	907.92	907.92	907.92	907.92	907.92	907.92	907.92	907.92	
7	Reserves (excluding Revaluation Reserves) as shown in the audited Balance Sheet	-	-	-	30,653.29	23,086.40	-	-	-	33,435.42	25,852.74	
8	Earnings Per Share (Face Value ₹10/-each) (not annualised for quarter)	17.95	18.30	15.24	90.85	64.72	15.36	21.89	17.83	91.02	77.44	
	a) Basic (₹)	17.95	18.30	15.24	90.85	64.72	15.36	21.89	17.83	91.02	77.44	
	b) Diluted: (₹)											

Notes:

- These standalone financial results have been prepared in accordance with Indian Accounting Standards ("Ind AS") prescribed under Section 133 of the Companies Act, 2013 read with the relevant rules thereunder and in terms of Regulation 33 of the SEBI ("Listing Obligations and Disclosure requirements") Regulations, 2015, as amended.
- The Company is engaged in the manufacture and sale of products which form part of a single product group which represents one operating segment. As the Chief Operating Decision Maker ("CODM") reviews business performance at an overall group level, disclosure requirement under Ind AS 108 on "Operating Segment" is not applicable.
- Performance of the plant in Rev. Division, Bharuch of the Company is reported as a cost centre for products used captively for manufacture of Gelatin and profit centre for products sold to external customers (including Group Company). To comply with pollution control board guidelines, the Company needs to incur additional expense for manufacture of one of the products exported from the division. The management was not utilising the installed capacity in full due to the higher manufacturing cost as mentioned above. In the opinion of management, the manufacture and sale of this product would qualify as a cash generating unit (CGU) as per Ind AS 36 as it represents an identifiable group of assets that generates cash inflows that are largely independent of the cash inflows from other assets or groups of assets. Though the Company started generating positive cash flows from these identifiable group of assets, there is an uncertainty in sustaining the current market price of the product in the coming quarters. Hence as a matter of prudence, management is of the view that the existing provision for impairment created in the books during previous period, based on impairment testing carried out then in the manner prescribed in Ind AS 36, amounting to ₹531.95 Lakhs is to be retained in books till sustainable positive cash flows are achieved from this identifiable group of assets.
- Other income for the year ended 31 March 2024 and 31 March 2023 includes dividend of ₹ 700.00 Lakhs and ₹ 472.50 Lakhs respectively, received from the subsidiary company.
- The Board of Directors has proposed a dividend of ₹ 0.7650 per preference share (@ 7.65063% p.a.) on 44,44,444 redeemable preference shares of ₹ 10/- each and a dividend of ₹ 6/- per equity share (60 % of the face value of ₹ 10/- per share) in their meeting held today which is subject to approval by the shareholders in the ensuing Annual General Meeting.
- With effect from 31 December 2022, the management decided to exercise the option permitted under Section 115BAA of the Income-tax Act, 1961 as introduced by the Taxation Laws (Amendment) Act, 2019. Accordingly, the deferred tax liabilities (net) as at 31 March 2022 and the estimate of tax expense for the year ended 31 March 2023 have been re-measured. Consequently, deferred tax expense for year ended 31 March 2023 includes a charge of ₹ 22.96 Lakhs, net of Minimum Alternate Tax ("MAT") credit written off amounting to ₹ 109.00 Lakhs.
- In view of the strong financial position of the Company based on its operational performance, the Board of Directors of the Company has decided to withdraw the proposal for the Rights Issue approved at their meeting held on 2nd January 2023, as the proposed investment for the expansion projects will be financed through internal accruals/borrowings which is more cost effective and will be in the interest of the Company.
- The Company is carrying a provision of ₹ 72.53 Lakhs as on 31 March 2024 (₹ 770.15 Lakhs as on 31 March 2023) towards slow moving inventory of fish protein and peptide.
- The financial performance of the Company is dependent on quality / availability of crushed bone, its price and market demand of finished goods.
- In accordance with National Highways Authority of India's ("NHAI") notification dated 26 May 2019 and subsequent communication by Sub Divisional Officer and Competent Land Acquisition Authority, Ballapur, a portion of the land belonging to the subsidiary company, Bamni Proteins Limited has been compulsorily acquired by NHAI. The compensation amounting to ₹ 303.95 Lakhs including interest was received on 12 January 2023. Compensation, net of written down value, amounting to ₹ 296.87 Lakhs has been accounted under "Exceptional item" in the financial statements for the year ended 31 March 2023. The Group has reserved the right for higher compensation and has filed an appeal for arbitration before the competent authority.
- Figures for the quarters ended 31 March 2024 and 31 March 2023 are the balancing figures between audited figures for the full financial year and the reviewed year to date figures upto the third quarter of the respective financial years.
- The Maharashtra State Pollution Control Board ("MPCB") vide their closure order dated 13 March 2024 has directed the subsidiary company, Bamni Proteins Limited ("the subsidiary") to stop the manufacturing activities at its factory in Bamni village, Chandrapur district, Maharashtra citing failure to comply with certain pollution control norms and conditions for the discharge of treated effluent by the unit as stipulated in the "consent to operate" letter issued by them. The subsidiary has stopped its manufacturing activities upon receipt of closure order. The management of the subsidiary believes that it has complied with all applicable norms stipulated in the consent to operate letter and the same was communicated to MPCB. The management of subsidiary also requested MPCB for an in-principle approval to lay a pipeline for the discharge of treated effluent water to a nearby river which has been declined by the MPCB vide its letter dated 30 April 2024. In the absence of technically and economically viable solution for resuming operations of the subsidiary's manufacturing activities on a sustainable basis, the Board of Directors of the subsidiary in their meeting held on 9 May 2024 decided to permanently close the manufacturing unit/factory of the subsidiary by 25 July 2024. Accordingly, the Board of Directors of the subsidiary based on their assessment, has concluded that the subsidiary has ceased to be a going concern and the financial statements of the subsidiary have been prepared on other than going concern basis, whereby, the assets are carried at lower of cost or estimated net realizable values and the liabilities are carried at their estimated settlement values. The Company has also recognised ₹ 337.58 Lakhs towards provision for employee benefits which includes notice period salary to administrative staff as per terms of employment, and notice pay wages and retrenchment compensation to workers considering that the notice of termination will be served on them shortly. Current/non-current assets amounting to ₹ 98.24 Lakhs, capital work-in-progress amounting to ₹ 22.12 Lakhs and deferred tax assets (net) amounting to ₹ 32.29 Lakhs were written down in the financial statements of the subsidiary as the estimated net realizable values of these assets were lower than their respective carrying values as on 31 March 2024. Further, assets and liabilities of the subsidiary have been reclassified wherever necessary to conform to the basis of accounting other than going concern and therefore prior period figures are not comparable.
- The above standalone financial results have been reviewed by the Audit Committee on 9 May 2024 and approved by the Board of Directors on 10 May 2024 at their respective meetings held on these dates. The statutory auditors have expressed a modified audit opinion on the consolidated financial results.

For Nitta Gelatin India Limited
Sd/-
Sajiv K Menon
Managing Director
DIN : 00168228

Kochi
May 10, 2024

STEL Holdings Limited									
CIN: L65993KL1990PLC005811 Regd. Office: 24/1624, Bristow Road, Willingdon Island, Cochin - 682003, Kerala. Email: secretarial@stelholdings.com , Website: www.stelholdings.com									
EXTRACT OF THE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2024									
(Rs. in lakhs)									
PARTICULARS	STANDALONE				CONSOLIDATED				
	QUARTER ENDED		YEAR ENDED		QUARTER ENDED		YEAR ENDED		
	31.03.2024	31.03.2023	31.03.2024	31.03.2023	31.03.2024	31.03.2023	31.03.2024	31.03.2023	
		AUDITED	AUDITED	AUDITED	AUDITED	AUDITED	AUDITED	AUDITED	
1	Total Income from Operations	1,347.64	1,318.83	1,846.41	1,716.17	1,347.64	1,318.83	1,846.41	1,716.17
2	Net Profit / (Loss) from Ordinary activities before Tax	1,331.22	1,291.42	1,774.90	1,642.35	1,331.00	1,291.22	1,773.98	1,641.30
3	Net Profit / (Loss) for the period after Tax	996.59	965.76	1,328.25	1,226.94	996.37	965.55	1,327.33	1,225.90
4	Total comprehensive income / (Loss) for the period	20,925.56	(8,388.74)	68,954.61	7,505.10	20,925.34	7,156.31	68,953.69	7,504.05
5	Equity Share Capital	1,845.54	1,845.54						